



MAW-001-001378

Seat No. _____

B. A. (Sem. III) (CBCS) Examination

October / November – 2016

Economics : Paper - V

(Macro Economics - I)

(Elective - I) (New Course)

Faculty Code : 001

Subject Code : 001378

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) દરેક પ્રશ્નના ગુણ પ્રશ્નની સામે દર્શાવવામાં આવ્યા છે.
(૨) પ્રશ્નોના જવાબ આંતરિક વિકલ્પના આધારે આપો.

- | | | |
|---|---|----|
| ૧ | ભારતમાં રાષ્ટ્રીય આવકનાં નીચા વૃદ્ધિ દરનાં કારણો જણાવો. | ૧૪ |
| | અથવા | |
| ૧ | કેઈન્સનો અસરકારક માંગનો સિદ્ધાંત સમજાવો. તેનું મૂલ્યાંકન કરો. | ૧૪ |
| ૨ | વ્યાજનો સમય પસંદગીનો સિદ્ધાંત સમજાવો. તેનું મૂલ્યાંકન કરો. | ૧૪ |
| | અથવા | |
| ૨ | ગુણકનો ખ્યાલ સમજાવો. ગુણકની પ્રક્રિયા સમજાવો. | ૧૪ |
| ૩ | મંદીનો ખ્યાલ સમજાવો. મંદીને દૂર કરવાના પગલાંઓની સમજૂતી આપો. | ૧૪ |
| | અથવા | |
| ૩ | મંદીનો ખ્યાલ સમજાવો. મંદીના કારણોની ચર્ચા કરો. | ૧૪ |
| ૪ | વપરાશવૃત્તિ પર અસર કરતાં પરિબળો ચર્ચો. | ૧૪ |
| | અથવા | |
| ૪ | વપરાશવૃત્તિ વધારવાના ઉપાયો જણાવો. | ૧૪ |
| ૫ | ટૂંકમાં નોંધ લખો : (કોઈ પણ બે) | ૧૪ |
| | (૧) રાષ્ટ્રીય આવકનાં અંદાજોની ઉપયોગિતા | |
| | (૨) GDP અને GNPના ખ્યાલ સમજાવો. | |
| | (૩) વપરાશ વિધેય | |
| | (૪) વ્યાજનો આત્મસંયમનો સિદ્ધાંત સમજાવો. | |

ENGLISH VERSION

- Instructions :** (1) Figures in the right side indicate marks.
(2) Give answers to questions on the basis of internal options.

- 1 Explain the causes of low growth rate of national income in India. 14

OR

- 1 Explain the effective demand theory of Keynes. Evaluate it. 14

- 2 Explain time preference theory of interest. Evaluate it. 14

OR

- 2 Explain the concept of Multiplier. Explain the process of multiplier. 14

- 3 Explain the concept of deflation. Explain the measures to solve the deflation. 14

OR

- 3 Explain the concept of deflation. Discuss the causes of deflation. 14

- 4 Discuss the factors determining the propensity to consume. 14

OR

- 4 Give the measures to increase propensity to saving. 14

- 5 Write short notes : (any two) 14

- (1) Usefulness of estimation of National Income.
- (2) Explain the concept of GDP and GNP.
- (3) Consumption function
- (4) Explain abstinence theory of interest.